



વડોદરા મહાનગરપાલિકા

(1) www.vmc.gov.in (2) www.vmcgov.com

જમીન મિલકત શાખા (ટી.પી)

ટી.પી. સ્કીમ નં.૧૬ (પ્રથમ ફેરફાર) વાસણાના પ્લોટ હોલ્ડરોએ પ્લોટના કબજા મેળવવા તથા ઈન્ફીમેન્ટલ કોન્ટ્રીબ્યુશનની રકમ ભરી જવા નોટીસ.

આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૦૨.૦૫.૨૦૧૬ ના અધિસૂચના ક્રમાંક:જી.એચ./વી/૮૩ ઓફ ૨૦૧૬/ટી.પી.એસ.-૧૨૨૦૧૬-૧૩૧૨-એલ થી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ -૬૫ હેઠળ ટી.પી સ્કીમ નં.૧૬ (પ્રથમ ફેરફાર) વાસણા સેચદ ને અંતિમ મંજૂરી મળેલ છે.

સદર હુ ટી.પી સ્કીમમાં સમાવિષ્ટ થતા પ્લોટ હોલ્ડરોને અત્રેની શાખાએથી ઉપરોક્ત કાયદાની કલમ ૬૭, ૬૮ તથા ૬૯ મુજબ કબજા ફેરફાર અંગે નોટીશ બજાવવાની કામગીરી ચાલુ છે. તથા જે પ્લોટ હોલ્ડરોના સરનામા તેમજ માલીકીમાં ફેરફાર થયેલ હોઈ તેઓએ તેમના માલીકીના રેવન્યું રેકર્ડો ૭/૧૨, ૮/અ તથા ૬ ના નવિન ઉતારા જમીન મિલકત શાખા, રામ નં-૧૩૬ માં રજુ કરી કબજા ફેરફાર અંગેની જરૂરી કાર્યવાહી કરાવી લેવા જણાવવામાં આવે છે. વધુમાં જાહેર જનતાના હિતમાં શહેરના વિકાસ અર્થે મુખ્ય રસ્તામાં તેમજ રીઝર્વ્ડ પ્લોટમાં ભળતી જમીન ના માલીકોએ રબરુ સંપર્ક સાધી ટી.પી એવોર્ડ પ્રમાણે પ્રાપ્ત થતા પ્લોટનો કબજો દિન-૧૦ માં મેળવી લેવો. સદર મુદત વિત્યા બાદ મહાનગર સેવા સદન તેનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી કરશે, તેમજ પ્લોટના ટી.પી એક્ટ હેઠળ ભરવાપાત્ર થતી ઈન્ફીમેન્ટલ કોન્ટ્રીબ્યુશનની રકમ ભરવા અંગે જાણ કરતી નોટીશ બજાવવાની કામગીરી પણ ચાલુ છે. તેમ છતા નામ, સરનામાના અભાવે નોટીશ ન મળે તો આ જાહેર સૂચનાથી પ્લોટ હોલ્ડરોને ઈન્ફીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ભરવા અંગેની જાણ કરવામાં આવે છે. ટી.પી એક્ટ ની જોગવાઈ મુજબ વિલંબિત ચુકવણી ઉપર નિયમ મુજબ ૯.૭૫% વ્યાજ લેવામાં આવશે.

પી.આર.ઓ. નં. ૬૯૧/૧૬-૧૭.

મ્યુનિસિપલ કમિશનર